

* સ□ ત□ થી-પુષ્પની સેક્સની સેક્સ લાઈફમં અનેક રૂંદી□ -વથ્થાગી□ જોવા મ્ને છે. નાની અમ્થ જીભને સ□ વાદમં અગણતિવથ્થાગી□ હોય છે. જેમ્કે મેહું વધે પડી ગયું, મ્ને લીંબુ તે ભવે જ નહીં! -વગેટે તેમ્ની જ તેહ તેહની વથ્થાગી□ નાના અમ્થ શશિ□ ન, હોઠ ત્થ ચોનમ્મિને હોય છે. આ થ્હી આવી અંગત જાણી-અજાણી, ક્રમ્કેની ની ચાદી□

* હોઠથી હોઠના સીધ રુંબ્ન (લીપ ટુ લીપ કીસ) ની વથ્થાગી. સ□ ત□ થી□ , ખાસ ક્થીને પત્થી ડીસ□ ટન□ સ અનુભવતે સ□ ત□ થી□ ને, આવી રુંદી હોય છે.

* રુંકની, લાળની, ચોનસિ□ ત□ થવની રુંદી.

* પથ્થેવાની, પથ્થેવાની ગંધની રુંદી.

* બ્ગલની ગંધની ત્થ ત્થાં થ્થ પથ્થેવાની રુંદી.

* □ થ્લ, □ નલ સેક્સની રુંદી

* જનનાંગોની આસપાસ દેખાત વાળની રુંદી.

* મ્ગદ□ વાથ્ને સ□ પથ્થ શ થ્થ જાય તેમ્ની રુંદી.

* શશિ□ ન અથ્થા ચો નમ્ને થ્થ સધિ સ□ પથ્થ શ ની રુંદી જનનાંગોને ગંદા ગણનાથ સ□ ત□ થી પુથ્થો આવી વથ્થાગી થી પીડાય છે.

* સ□ ત્મસ□ પથ્થ શ, સ□ ત્મથ્થ દનની રું થું ઈ, ઘણી સ□ ત□ થી□ સ□ ત્મ સ□ પથ્થ શ થ્થાથી અકળાઈ જાય છે.

* સેક્સ દથ્થિાન અજ વાળુ, ફુલલાઈટ હોય તે તેમ્ની રુંદી, કેટલાકને ઈવન ડીમ્લાઈટનીય રુંદી હોય છે. સામે છેડે અંધથની રુંદી વાળાચે હોય છે.

* પથ્થથી ડેડશીટની ચેખ□ ખાઈની રુંદી કેટલાકને ડેડશીટ રુંથ્થ જશે તે □ વી ત્થ સહત્મ્ની રુંદી હોય છે. કેટલાકને અન□ ચો□ વાપથેલી ડેડશીટની રુંદી હોય છે કેટલાકને ચદથ સ□ થવોથી ગંદી થ્થ જાય તેમ્ની વથ્થાગી હોય છે. □ શક્તિનો પીલોકવથ્થની થ્થાઈની રુંદી□ પણ સામન□ ચ છે.

* જગ□ ચાની રુંદી, ફલાણી ત્થ મુથ્થ જ હોવુ જોઈ□ , બથીની નજીક ન જ સુવાય, ઉપથ પંખો જોઈ□ જ, □ થ્કન□ ડીશન□ ડ □ ન ક્થ□ ચા વગથ સેક્સ ન જ ભેગવાય, આવા પ□ થ્કાથ્થની ચે પાયવાથ વથ્થાગી□ લોકો ઘથવે છે. * ખંજવાળ, છીંક, ઉઘથ્સ, શથ્દી, વાછૂટ, મથના વાળ ઉત્થવા, અસ□ વચ્છ છ અંડથ્થાથ્થેન□ ટ પહેથ્થવા જેવા પાથ્થ ટનથ્થા વ□ ચહવાથે પ□ થ્ત□ ચે પણ જબ્થ્થસ□ તરુંદીનો દાખવનાથ સ□ ત□ થી પુથ્થો મેજુદ છે. * આસનોની રુંદી, મ્ને ઉપથ થ્થેવાનુ તે ન જ ફાવે આ થીતેવળી સંબ્થથય? આવુ ઘણા ડેડથ્થમ્ વાથ્થવાથ બેલાય છે. * સમ્થની રુંદી, ઘણાને સુત પહેલા સેક્સ ન જ ફાવે, તે કેટલાકને મ્ગસ□ કે ઉઠીને સેક્સ ક્થ્થામં. ત□ થ્થસ લાગે. ઘણાને પાથ્થ ટનથ્થની બ્થોથે કે સાંજે સેક્સની મંગણી અજુગતે લાગે છે.

* બળકોની હાજથીની રુંદી. ઘણાને ઘસઘસાટ ઉઘત બળકોની હાજથીમં સેક્સ ક્થ્થવાનુ અણગમ્તુ લાગે છે. કેટલાકને તે વળી બજુના થ્થમં સુતેલા વડીલોની ચ વથ્થાગી હોય છે.

* સ□ નાન અમ્કને □ વી રુંદી હોય છે કે સ□ નાન ક્થ□ ચા બદ જ પ□ થે થય. તે અમ્કને વળી □ વું હોય છે કે સંભેગ બદ સ□ નાન ક્થ્થવું જ પડે. કેટલાકને સાથેસ□ નાન ક્થ્થવાની રુંદી હોય છે.

* ફોટો લે ત્ય આફ્ટર લેની પણ રૂંધી હોય છે. અમુક સમયે થી પુસ્તકો આ બે મહત્વની પાઠ્યક્રમ યોજાય છે ઊભાઈ જતં જોવા મળે છે. *
નવિધ્મી, ટુ-ડેની, નવિધપહેલ્યા-કાટવા-ફેંકવા કે ડીઝપોઝ કથ્યાની ચ રૂંધી નોંધઈ છે.

* આ જ થીતેડેન રથ, રથ મ, કોન ટેકટ લેન સ, સ ટોકીંગ ઝ, સ વીશ્વચુટ, દાઢી-મંછ, લાંબ નખ, બેડી ડી ડચ્ચ ટ,
પથ્થુમ-પાવડથ, લીપ સ ટીક, હેથેન ડ, જવેલથી વગેથે સમગ્ર ટાણે થખવા કે ન થખવા તેની પણ અનેકવધિરૂંધી ધ્યવતં સમયે થી
પુસ્તકો જોવા મળે છે.

* સમગ્ર ટાણે આવત ફોનકોલ, મેબઈલ, બહાર થં અવાજ, ચલુ ટેલીવીઝન સેટ વગેથેની ચ રૂંધીવાળા લોકો ઇ નથી.

* કેટલાકને બેડુથ સવાય નવે સમયો સેક્સ કથ્યાની વથ્યાગી હોય છે.

* ઈથેટકિ મ્સાજ, પથેમલાપ, નચૂડીટી (નગનત)નીચ કેટલાકને રૂંધી હોય છે. ઈથેટકિ વસમયે થે પહેલ્યાની ચ રૂંધી કેટલાક ધ્યવે છે.

* રૂંધી ટૂંકમં અગણતિહોય છે. ઇ સેસીવ વચક્તિ વ ધ્યવનાથને વધુવથ્યાગી હોય છે. વથ્યાગી ખૂબ નાની હોય તે સહચ
પણ હોય છે. પણ થીજીડ, દૂઠ ન કથી શકાય ઇ વી વથ્યાગી સેક્સ લાઈફ બગાડે છે. કમ રૂંધી ધ્યવનાથ વચક્તિ પાથ ટનથે ધીથ્થ
થખવી, સમ્જાવટથી કમ લેવું. કેટલીક રૂંધી જેનચુઈન પણ હોય છે. રૂંધી , ભ્ય , ફોબિયા , શથ , સંસ કાથ વગેથેને અલગ ઇ ળખવા
જૂથી છે. અને છેલ લે રૂંધી છોડી શકાય ઇ વી ચીજ છે.

{jcomments off}